



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૦૫/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૯૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૨ કેસ કરી, ૫૯ વ્યક્તિઓને ઝડપી, ૪૦૬ લીટર દેશી દારૂ, ૭૧ બોટલ ઇંગ્લીશ દારૂ, ૫ બિયર ટીન અને ૨ સ્ફૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૨૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૨,૬૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૯૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૯૦૦/૧૯

સોલા હાઈકોર્ટ: અનિલકુમાર મગનભાઈ ડોબરિયા (રહે.સાનિધ્ય રેસીડન્સી આવાસ ફ્લેટની બાજુમાં પાવાપુરી ઘાટલોડીયા) એ તા.૨૫/૫/૧૯ નારોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે જુન-૨૦૧૫ થી ફેબ્રુઆરી-૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી સુશીલકુમાર ગૌરીકાંત ઝા (રહે. ગાયત્રી એક્સપ્લોટીકા લાંભા ગામ) એ સોલા ચાણક્યપુરી રોડ દિશાત પેટ્રોલપંપ ખાતે અનિલકુમાર ડોબરીયાની કંપનીના વાહનોમાં ડીઝલ પુરાવવા માટે કંપની તરફથી ઇન્ડિયન ઓઈલ કંપનીના પેટ્રો કાર્ડનો દુર ઉપયોગ કરી દિશાંત પેટ્રોલીયમ પંપ ચાણક્યપુરી સોલા ખાતેના પેટ્રોલપંપ પર ડીઝલ પુરાવ્યા વગર પેટ્રો કાર્ડ સ્વાઈપ કરી રોકડ રૂપિયા ૫૮,૫૫,૪૦૦/- મેળવી લઈ કંપનીમાં જમા નહી કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જે.હુણ ચલાવે છે.

ગાયકવાડ હવેલી: સોએબ સ/ઓ હનીફભાઈ વ્હોરા (રહે. કોટની રાગ જમાલપુર કાયની મસ્જીદ જમાલપુર) એ તા.૨૫/૫/૧૯ નારોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આશરે આઠેક મહિના અગાઉથી તા.૦૯/૦૫/૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન સોએબ વ્હોરાના મિત્ર આરોપી (૧) મોહમદ રીઝવાન ફાઝલભાઈ પાલીવાલા (૨) ફાઝલભાઈ સમસુભાઈ પાલીવાલા (બન્ને રહે. સૈયદવાડો આસ્ટોડીયા દરવાજા જમાલપુર) એ ભેગા મળી સોએબ વ્હોરા પાસેથી ઘંઘા અર્થે એક મહીના માટે હાથ ઉછીના રૂપિયા ૧૨,૨૫,૦૦૦/-લઈ પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.એસ.રાઠોડ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૯૦૧/૧૯

કાગડાપીઠ: દીલીપભાઈ વાસુલાલ રૂપરેલ (ઉ.વ. ૪૮) (રહે. ચોથો માળ શક્તિ પેલેસ કોનાર્ક કરિશ્મા બિલ્ડીંગ રેણુકા હોલ પાસે વસ્ત્રાપુર) એ તા.૨૫/૫/૧૯ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૫/૧૯ રાતના ૧૦/૦૦ થી તા.૨૧/૫/૧૯ સવારના ૧૦/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રિક્ષામાં આવેલ બે પુરૂષ સફલ-૩ “ઈ” બ્લોક પહેલા માળે દુકાન નં-૧૫૨ શિવાલી ફેશન પ્રા.લિ.નામની દુકાનની સામે ગેલેરીમાંથી રેડીમેડ લેડીઝ ડ્રેસનું પાર્સલ કિંમત રૂપિયા ૧,૦૮,૮૩૫/- ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.પટેલ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૦૨/૧૯

શહેરકોટડા: મનોજભાઈ નટવરભાઈ પટણી (ઉ.વ.૩૮) (રહે. લક્ષ્મીશંકર આચાર્યની ચાલી, શારદાબેન હોસ્પિટલ પાછળ સરસપુર) એ અગમ્ય કારણસર તા.૨૪/૦૫/૧૯ રાતના સમયે પોતાના ઘરે લોખંડની પાઈપ સાથે સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.આઇ ચૌધરી ચલાવે છે.

નિકોલ: આરતીબહેન રવિભાઈ બોડકે (ઉ.વ.૨૬) (રહે. ઇન્દિરા વસાહત હુડકો સિંગરવા તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ) એ અગમ્ય કારણસર તા.૨૫/૦૫/૧૯ બપોરના ૨/૩૦ થી ૫/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મદદનીશ પોલીસ કમીશનરશ્રી “આઈ” ડીવીઝન ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.